



AAC-009-001424

Seat No. _____

B. R. S. (Sem. IV) (CBCS) Examination

March / April - 2016

403 : Economics

(Core - 11) (New Course)

Faculty Code : 009

Subject Code : 001424

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

1 M.C.Q.

20

- (1) સામાન્ય રીતે વ્યાપારી બેંકો દેવાં પ્રકારના ધિરાણ આપે છે.
 (A) ટૂંકાગાળાના (B) મધ્યમગાળાના
 (C) લાંબાગાળાના (D) અન્ય
- (2) જો નાણાંના દરમાં ઘટાડો થાય તો વ્યાજના દરમાં વધારો થાય છે.
 (A) અસત્ય (B) સત્ય
 (C) અર્ધસત્ય (D) વિવાદાસ્પદ
- (3) ટૂંકી નોટિસ આપીને ધિરાણની રકમ પરત મેળવી શકાય તેવા ધિરાણને શું કહેવાય છે ?
 (A) બાંધી મુદત ધિરાણ (B) અલ્પકાલીન ધિરાણ
 (C) (A) અને (B) બંને (D) અન્ય
- (4) બચત થાપણોમાં વ્યાજની ગણતરી દર કેટલા મહિને કરવામાં આવે છે ?
 (A) 4 (B) 6
 (C) 8 (D) 12
- (5) બચત થાપણો પર મુદતી થાપણો કરતાં કેટલું વ્યાજ આપવામાં આવે છે ?
 (A) બમણું (B) અડધું
 (C) ઓછું (D) નહિવત્

- (6) માલ્થસે વસ્તીનો સિદ્ધાંત કયારે રજૂ કર્યો હતો ?
 (A) 1780 (B) 1798
 (C) 1998 (D) 1782
- (7) નાણાનું સૌથી વધુ અગત્યનું કાર્ય શું છે ?
 (A) વસ્તુ ખદીરી (B) મૂલ્યસાપેક્ષ
 (C) મૂલ્યનિર્ધારણ (D) અન્ય
- (8) ભારતમાં 1969માં કેટલી વ્યાપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?
 (A) 10 (B) 14
 (C) 12 (D) 20
- (9) ઈમ્પિરીયલ બેંક ઓફ ઈન્ડિયા ભારતમાં કયારે સ્થાપવામાં આવી હતી ?
 (A) 1921 (B) 1910
 (C) 1930 (D) 1938
- (10) નાણું વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક કડીનું કામ કરે છે. એવું કયા અર્થશાસ્ત્રીએ કહ્યું ?
 (A) માલ્થસ (B) રેકાર્ડો
 (C) કેઈન્સ (D) અન્ય
- (11) મધ્યસ્થ વ્યાપારી બેંકોના કયા સાહસિક તરીકેની કામીગીરી બજાવે છે ?
 (A) મધ્યસ્થી (B) અંતિમ સહાયક
 (C) નિર્ણાયક (D) અન્ય
- (12) ખોટા ધિરાણો એ કોની સમસ્યા છે ?
 (A) નફાકારકતાની (B) વ્યાજ વટાવ
 (C) મૂડીપતિઓ (D) અન્ય
- (13) નાણાનું સૌથી મહત્વનું કાર્ય કયા માધ્યમનું છે ?
 (A) ફુગાવા (B) વેચાણવેરા
 (C) વિનિમય (D) ખરીદી

- (14) અવિકસિત નાણાં બજારનું માળખું કેવું હોય છે ?
 (A) સંકલિત (B) બિનસંકલિત
 (C) (A) અને (B) બંને (D) અન્ય
- (15) નાણાંના પુરવઠામાં ક્યારથી ફેરફાર કરવામાં આવ્યા હતા ?
 (A) 31 માર્ચ 1981 (B) 12 માર્ચ 1930
 (C) 10 માર્ચ 1922 (D) અન્ય
- (16) ઓવરડ્રાફ્ટ સગવડ કયા ખાતાધારકોને મળે છે ?
 (A) ચાલુ ખાતું (B) બચત ખાતું
 (C) લોન ખાતું (D) અન્ય
- (17) ભારતમાં દરેક ચલણી નોટો પર કોની સહી હોય છે ?
 (A) કમિશનરની (B) બેંકના ગવર્નરની
 (C) રિઝર્વ બેંકના ગવર્નરની (D) અન્યની
- (18) નાણાંના મૂલ્યની વ્યાખ્યા કોણે આપી હતી ?
 (A) માર્શલ (B) રિકાર્ડો
 (C) ફિશર (D) અન્ય
- (19) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ?
 (A) 1920 (B) 1997
 (C) 1980 (D) 1969
- (20) બેંકની સૌ પ્રથમ વ્યાખ્યા કોણે આપી હતી ?
 (A) સી.આર.નાયડુ (B) સી.આર.પાટીલ
 (C) આર.આર.ઐયર (D) અન્ય

- 2 સર્જિત થાપણો એટલે શું ? અર્થ આપી સર્જિત થાપણો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિઓ જણાવો. 10
- 3 કોઈ પણ એકનો જવાબ આપો. 10
- (1) નાણું એટલે શું ? નાણાંના વિવિધ પ્રકારો સમજાવો.
- (2) વ્યાપારી બેંકોનું મહત્વ સમજાવો.
- 4 રાષ્ટ્રીયકૃત બેંકોની સમસ્યાઓને વિગતે સમજાવો. 10
- અથવા**
- 4 મધ્યસ્થ બેંક એટલે શું ? તેના હેતુઓ અને મહત્વ લખો. 10
- 5 ટૂંકનોંધ લખો. (કોઈ પણ બે) 10
- (1) ગુણાત્મક શાખ નિયંત્રણ
- (2) નાણાંના લક્ષણો
- (3) શાખ નિયંત્રણના હેતુઓ.
- 6 બેંક ભંડોળના સ્રોત તરીકે પ્રાથમિક થાપણોનો અર્થ, સ્વરૂપ અને પ્રકારો સમજાવો. 10